



LESHA INDUSTRIES
L I M I T E D

August 10, 2022

To,
Department of Corporate Services
BSE Limited
Ground Floor, P. J. Tower,
Dalal Street, Fort,
Mumbai- 400 001

Security ID: LESHAIND
Security Code: 533602

Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2022.

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2022 as per the Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

For Lesha Industries Limited

Himani Upadhyay
Company Secretary
Membership No. A67689



Encl: As above

7th Floor, Ashoka Chambers,
Mithakhali Six Roads,
Ahmedabad - 380 006.
Phone : +91 - 79 - 26463227
Web : www.lesha.in
E-mail : info@lesha.in
CIN: L27100GJ1992PLCO18607

Gujarat: 'Government battling LSD outbreak with limited resources'



GANDHINAGAR: The state government has been battling outbreak of the lumpy skin disease (LSD) with limited resources in veterinary hospitals across the state, reveal official figures.

According to the data provided by the state government in the Gujarat assembly earlier this year, 290 posts of veterinary doctors and vacant in government hospitals for animals.

Similarly, there are 290

of the lumpy skin disease among cattle.

The party said that in Gujarat, there is one veterinary officer for every 73,477 cattle head. Similarly, for every 1,05,749 cattle head, the government has appointed one veterinary inspector. In terms of dressers available at government veterinary hospitals, official figures say that there are 3,45,718 cattle head for one dresser.

"A large number of cattle head have died in the lumpy skin disease outbreak because the government does not have enough doctors and other paramedical staff to treat the cattle head," said state Congress spokesperson Manish Doshi.

He added that the state also did not take any steps to control the disease although the first case of LSD was reported way back in May this year.

Doctors at HCG Hospitals successfully conduct spinal osteotomy procedure

Ahmedabad, HCG Hospitals, Ahmedabad, successfully conducted a spinal osteotomy procedure on a 12-year-old girl, Rekha (name changed), who was suffering from rare congenital scoliosis (sideways curving of the spine), which resulted in a hunched back. This condition was caused due to abnormal growth of the vertebrae. A complex procedure was performed by breaking the fused backbone and reorienting the same while preserving the functions of the spinal column. The girl also suffered from multiple congenital conditions, including a single kidney, and also underwent heart surgery at the age of 8 months. This complex surgery for spinal correction was conducted by Dr. Amit Jhala, Consultant - Spine Surgery, HCG Hospitals, and a team of doctors at HCG hospitals. Rekha had a difficult childhood, facing multiple conditions due to birth defects. She suffered from myelomeningocele since birth which is associated with other organs as well.

She also suffered from Autism Spectrum Disorder, a developmental disability that affects socialization, communication and behavior. When she was 8 months old, Rekha had a hole in the upper chamber of her heart and had open-heart surgery in Ahmedabad. (19-10)

CM Bhupendra Patel highlights Gujarat feats at NITI Aayog meeting



GANDHINAGAR: Chief minister Bhupendra Patel highlighted the achievements of the Gujarat government in the fields of urban development, education and agriculture at the 7th meeting of the governing council of NITI Aayog in New Delhi on Sunday. Patel said Gujarat has been ranked among the top states in various categories of Good Governance Index, Logistics, Performance Index, State Energy and Climate Index, Export Preparedness Index and SDG India Index 3.0 released by Government of India. He added that the state has also taken up several

ambitious projects like GIFT City, 30 GW Hybrid Renewable Energy Park, Dhokra SIR and Statue of Unity among others, a CMO statement said.

Commenting on urban development, the CM said that his government has given top priority to various welfare activities through well-planned urban development planning and citizen-oriented governance. Gujarat has prepared a three-tier urban development roadmap for cities, he added.

Speaking on the new education policy, Patel said a task force was set up in 2020 itself to oversee implementation of the national education policy.

Motorola launches moto g32 with a brilliant 90Hz 6.5" FHD display



Ahmedabad, Today, Motorola announced the launch of its latest smartphone in the g series franchise, the moto g32. A device that is truly #AllYouWant. Launched at a starting price of 121,999, consumers can buy it at an amazing offer price starting just 71,749** (including up to Rs. 1,250 Instant Discount on HDFC Bank credit cards). With a super smooth 90Hz HD+ 6.5" FHD display, the device allows clearer and sharper views and transitions. Along with this brilliant display, the moto g32 features stereo speakers with Dolby Atmos® enabling the user to immerse in fuller sound, better clarity, and improved bass on every beat.

LESHA INDUSTRIES LIMITED

Registered Office: 7th Floor, Ashoka Chambers, Mithakhall Six Road, Ahmedabad 380 006. CIN: L27100G91992PLCO18607

Particulars	UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (Rs. In Lacs)		
	Quarter ending	Previous Year ended	Corresponding 3 months ended in the previous year
	30-06-2022	31-03-2022	30-06-2021
	Unaudited	Audited	Unaudited
Total income from operations	283.67	724.73	129.82
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	36.53	47.10	3.03
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	36.53	47.10	3.03
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	33.79	40.07	3.03
Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	33.79	40.07	3.03
Equity Share Capital	1100.00	1100.00	1100.00
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)	0.03	0.04	0.003
Diluted:	0.03	0.04	0.003
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)	0.03	0.04	0.003
Diluted:	0.03	0.04	0.003

Notes:
The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.lesha.in)

For, LESH A INDUSTRIES LIMITED
Ashok C. Shah
Managing Director
DIN: 02467830

Date : 08/08/2022
Place : Ahmedabad

SUNGOLD CAPITAL LTD

Regd. off: House No. 7/13, opp White Tower, Station Road, Nanod, Rajpipla Narmada - 393145. Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064. Website: www.sungoldcapitallimited.com | Email: info@sungoldcapitallimited.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (Rs. In Lakhs, except per share data)

Sr. no.	Particulars	Year to date Figures / Previous year ending in the previous year		
		Quarter ended 30-06-2022	31-03-2022	30-06-2021
1	Total Income from Operations	46.161	135.972	38.012
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3.253	4.834	2.525
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	3.253	4.834	2.525
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3.048	3.617	2.367
5	Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	3.048	3.617	2.367
6	Equity Share Capital (Face value of Rs. 10/-)	1840.350	1840.350	1840.350
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	364.450	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic (b) Diluted	0.017 (0.017)	0.020 (0.020)	0.013 (0.013)

NOTES:
The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Tuesday, August 09, 2022. The above is an extract of the detailed format of financial result filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of Financial Result is available on Stock Exchange website www.bseindia.com and on company's website, www.sungoldcapitallimited.com. The Company has three reportable segments which are NBFC, Entertainment and software development.

For Sungold Capital Limited
Rajiv Kotia
(Chairman & Managing Director)
DIN: 00135912

INDOSTAR HOME FINANCE PRIVATE LIMITED

Registered Office: One Wing Centre, Tower 2A, 23rd Floor, Jupiter Mills Compound, 8 B Ring, Mumbai - 400013, India. Email: contact@indostarcapital.com. CIN Number: U65900MH2016PTC271587. Contact No. - Mr. Vijay Bhagat 9616380591.

NOTICE OF SALE OF PRIVATE TRUST

[See Rule 8(b) read with 9(1) of the Securities Interest (Enforcement) Rules, 2022] SALE OF IMMOVABLE ASSETS CHARGED TO THE INDOSTAR HOME FINANCE PRIVATE LIMITED UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 (SARFAESI ACT)

Name of Borrower(s)	Date & Amount of Demand Notice	Description of Property	Reserve Price	Date & Time of Private Treaty
LAN No. - LNSURHOH.01190008652 & LNSURHOH.01190008653 Branch: Surant Road Borrower(s) Name(s): 1. Madantia Mohanta Gurjar (Borrower) 2. Vahanaba Madantia (Co-borrower) 3. Lefantia Mohanta (Co-borrower)	15/02/2022, 113,83,968/- (Rupees Thirteen Lakh Eighty Three Thousand Nine Hundred Sixty Eight Only) as on 27-01-2022 along with further interest and charges unit payment	Property Bearing - Plot No. 3 (As Per Plan A Type Garden Valley Nr. Aradhna Palace & Jolva Gram Panchayat Office, Jolva Village, Tal. Palasana, Dist. Surat 3 India Gujarat. Surt - 394305. Four Boundaries - North - Plot No. 4, South - Plot No. 2, East - Society Road, West - Block No. 88	₹ 16,50,000/- (Rupees Ten Lakh Fifty Thousand Only)	26/08/2022 10:30 AM To 4:30 PM

- Standard terms & conditions for sale of property through Private Treaty are as under:**
- Sale through Private Treaty will be on "As is Where is Basis", "As is What is Basis", "Whatever is There is Basis" and "No recourse Basis".
 - The purchaser will be required to deposit 25% of the sale consideration on the next working day of receipt of acceptance to terms and conditions for sale and the remaining amount within 15 days thereafter.
 - The purchaser has to deposit 25% by way of Demand Draft in favor of "INDOSTAR Home Finance Private Limited" or by way of RTGS/NEFT to the account details mentioned as follows: Bank Name: INDUSIND BANK Ltd, Nariman Point, Mumbai, Bank Account No.: 25989277386, IFSC Code: INDUS000606, along with self-attested copies of the PAN Card, Aadhar Card, Residence Address Proof, Board Resolutions in case of company and Address Proof.
 - Failure to remit the amount as required under clause (2) above, will cause forfeiture of amount already paid including 25% of the amount paid.
 - The property is being sold with all the existing and future encumbrances unknown to the Authorized Officer/Secured Creditor. The Authorized Officer/Secured Creditor shall not be responsible in any way for any third-party claims/rights due to the purchaser.
 - The purchaser should conduct due diligence on all aspects related to the property under sale through private treaty to his satisfaction. The purchaser shall not be entitled to make any claim against the Authorized Officer/Secured Creditor in this regard at a later date.
 - The Authorized Officer of the Secured Creditor reserves the right to reject any offer of purchase without assigning any reason.
 - In case of more than one offer, the Authorized Officer of the Secured Creditor will accept the highest offer.
 - The Successful Purchaser shall bear any statutory dues, taxes, fees payable, stamp duty, registration fees, etc. that is required to be paid in order to get the property conveyed/delivered in his/her favor as per the applicable law.
 - Sale is subject to the confirmation by the Authorized Officer of the Secured Creditor.
 - The Borrower(s) are hereby given 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002 to pay the sum mentioned as above before the date of Private Treaty failing which the immovable property will be sold by Private Treaty and balance, if any, will be recovered with interest and costs.
 - The Total Loan Outstanding amount is not the loan foreclosure amount. Further interest and all other charges (if any) shall be calculated at the time of closure of the loan.
 - The Authorized Officer/Secured Creditor shall not be responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be sold on "As is Where is Basis", "As is What is Basis", "Whatever is There is Basis" and "No recourse Basis".
 - The sale has to be registered at the earliest else the purchaser has to give the request letter to the Authorized Officer of the Secured Creditor mentioning the reason of delay for the registration.
 - The interested parties may contact the Authorized Officer for further details/clarifications and for submitting their application.
 - Sale shall be in accordance with the provisions of SARFAESI Act/Rules.

Place: SURAT Date: 08/08/2022
Sd/-
Authorized Officer
Indostar Home Finance Pvt. Ltd.

Four men kill a 65-year-old man during loot in Ahmedabad

AHMEDABAD: Four men from the Meghanagar area of the city late on Friday night killed a 65-year-old man during a loot.

The elderly man died when the four men aged between 20 and 25, hit him and he fell on the ground during which he suffered skull injuries and died in Kubernagar.

According to the police officers, the four men were short of money to hold a party for which they killed a man identified as Rajkumar Bhumihar from Charanagar. Three of them were arrested on Saturday by city police.

Police said that the accused were identified as Mayur Gani, Sunil Yadav, Sahil Salwani and Jatni Jaglani, from Kubernagar.

While investigating the death of Bhumihar on Friday, police were told by a witness that he had seen four youths beating Bhumihar, Police, with the help of CCTV footage and technical surveillance, identified the accused persons.

POONAWALLA HOUSING FINANCE LIMITED

Registered Office: 602, 6th Floor, Zero One IT Park, Sr. No. 79/1, Ghorpada, Mundhwa Road, Pune - 411036

APPENDIX IV (See rule 8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Poonawalla Housing Finance Limited (Formerly known as Magma Housing Finance Limited) of the above Corporate/ Register office under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred as the "said Act") and in exercise of the powers conferred under Section 13 (12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a demand notice below dated calling upon the below Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act read with Rule 3 of the said rules of the said Rules of the Security Interest Enforcement Rules 2002 on this 08th day of August of the year 2022.

The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Poonawalla Housing Finance Limited (Formerly known as Magma Housing Finance Limited) the amount and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. Details of Property taken in possession are herein below.

Sr. No.	Name of Borrowers	Description of Property	Symbolic Possession taken Date	Date of statutory Demand Notice	Amount in Demand Notice (Rs.)
1	USDAD RAKESH JAGDISHBHAI, SAROJBEN RAKESHBHAI USDAD DAVARA PANKAJBHAI DHIRUBHAI	ALL THAT PIECE AND PARCEL OF MORTGAGED PROPERTY OF PROPERTY BEING FLAT NO. 503 ADMEASURING SUPER BUILT UP AREA ABOUT 50 FEET X 90.61 SQ METERS AND BUILT UP AREA ABOUT 59.20 SQ. METERS ON 5TH FLOOR IN BUILDING "M", ALONG WITH UNDIVIDED SHARE ADMEASURING ABOUT 40.59 SQ. METERS IN THE LAND IN THE SCHEME KNOWN AS HARIKRUSHNA RESIDENCY, FORMING PART OF LAND BEARING BLOCK NO. 338/B OF MOUJE UMRPA OF OLDPA TALUKA IN THE REGISTRATION DISTRICT AND SUB DISTRICT OF SURAT, WHICH IS BOUNDED AS UNDER: NORTH: ADJ. BLOCK NO. 337; SOUTH: ADJ. ROAD. EAST: ADJ. BLOCK NO. 338; WEST: ADJ. BLOCK NO. 338/A.	08/08/2022	26-Mar-22	Loan No. HF/0190/H/19/100054 Rs. 1,12,07,65.2/- (Rupees Eleven Lakh Twenty Thousand Seven Hundred Sixty Five Paise Twenty Only) payable as on 26/03/2022 along with interest @ 12.50% p.a. till the realization.
2	BHAVESHKUMAR JADURAM DUDHAREJA, RANIBEN BHAVESHBHAI DUDHREJIA	ALL THAT PIECE AND PARCEL OF MORTGAGE PROPERTY OF R/S NUMBER 140, BLOCK NUMBER 139, PLOT NUMBER 36 TO 43 FLAT NO. 103 FIRST FLOOR OF BUILDING NUMBER E, SAMARPAN TOWNSHIP, CONSTRUCTED ON LAND SITUATED AT MOUJE: KAMREJ GAM. TAL: KAMREJ, DIST: SURAT SURAT PIN 394140.	08/08/2022	18-Nov-21	Loan No. HM/0190/H/18/101147 Rs. 1,37,25,12.1/- (Rupees Thirteen Lakh Seventy Two Thousand Five Hundred Twelve Only) payable as on 18/11/2021 along with interest @ 12.50% p.a. till the realization.
3	ATUL KUMAR YADAV, SARITA DEVI	ALL THAT PIECE AND PARCEL OF MORTGAGE PROPERTY OF FLAT NO. 303 SHIVAM APARTMENT, 3RD FLOOR, CONSTRUCTED ON LAND BEARING PLOT NO.8 & 9 IN ANKUR NAGAR TENAMEN NO.2 DEVELOPED UPON LAND SITUATED AT MOUJE SAYAN, BEARING R/S NO.86 TAL. OLAPAD, DIST. SURAT SURAT PIN 394130. BOUNDARY: EAST: FLAT NO. 304, WEST: FLAT NO. 302, NORTH: GOPAL RESIDENCY, SOUTH: PASSAGE.	08/08/2022	18-Nov-21	Loan No. HM/0190/H/18/101187 Rs. 64,436.1/- (Rupees Six Lakh Forty Four Thousand Three Hundred Sixty One Only) payable as on 18/11/2021 along with interest @ 12.00% p.a. till the realization.
3	SANNY SOLANKI, RAMESHBHAI P SOLANKI, SOLANKI GIRISHBHAI RAMESHBHAI, SOLANKI MANJUBEN RAMESHBHAI	ALL THAT PIECE AND PARCEL OF MORTGAGED PROPERTY OF PROPERTY BEARING PLOT NO. 9 ADMEASURING 60.22 SQ. MTS. ALONG WITH 33.18 SQ. MTS. UNDIVIDED SHARE IN THE LAND OF ROAD & COP. TOTAL ADMEASURING 93.40 SQ MTS. IN "NILKANTH VILLA", SITUATE AT SURVEY NO. 348, 350/2 351, BLOCK NO. 327/A ADMEASURING 8100 SQ. MTS., OF MOUJE VILLAGE KUVARDA, TA: MANGROL, DIST: SURAT, OWN BY: (1) MANJUBEN RAMESHBHAI SOLANKI (2) GIRISHBHAI RAMESHBHAI SOLANKI & (3) SUNNY RAMESHBHAI SOLANKI.	08/08/2022	17-Mar-22	Loan No. HM/0190/H/18/100181 Rs. 1,20,42,42.69/- (Rupees Twelve Lakh Four Thousand Two Hundred Forty Two Paise Sixty Nine Only) payable as on 17/03/2022 along with interest @ 12.00% p.a. till the realization.

Date: 10-08-2022
Place: Gujarat
Authorized Officer
Poonawalla Housing Finance Limited
(Formerly known as Magma Housing Finance Limited)

